

B.Com. Semester - 5 (Remedial) (CBCS) Examination**March/April-2026 (NEW COURSE)****Auditing and Corp. Governance - 1(Dse-1)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	(A) ઓડિટીંગની વ્યાખ્યા આપી ઓડિટીંગના ઉદ્દેશો ચર્ચો.	(૧૦)
	(B) કોમ્પ્યુટરાઈઝડ હિસાબી પદ્ધતિનું મહત્વની સમજાવો.	(૧૦)
	અથવા	
પ્રશ્ન.૧	(A) ચાલુ (સતત) ઓડિટ એટલે શું? તેના ફાયદાઓ અને મર્યાદાઓ જણાવો.	(૧૦)
	(B) ઓડિટ કાર્યક્રમ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ સમજાવો.	(૧૦)
પ્રશ્ન.૨	આંતરિક અંકુશનાં હેતુઓ જણાવી આંતરિક અંકુશની પદ્ધતિના સિધ્ધાંતો જણાવો.	(૨૦)
	અથવા	
પ્રશ્ન.૨	વાઉચિંગ એટલે શું? નીચેનાનું વાઉચિંગ તમે કઈ રીતે કરશો?	
	(1) મળેલ કમિશન. (2) મનોરંજન ખર્ચા (3) પગાર	
પ્રશ્ન.૩	મિલકતોની ચકાસણી અને મુલ્યાંકન અંગે ઓડિટરની ફરજો જણાવો.	(૧૫)
	અથવા	
પ્રશ્ન.૩	નીચેનાની ચકાસણી અને મુલ્યાંકન કરો(કોઈ પણ બે)	
	(1) ડિબેન્યર્સ (2) રોકાણો (3) પાઘડી	
પ્રશ્ન.૪	કોર્પોરેટ ગવર્નન્સના મૂળતત્વો (સિધ્ધાંતો)ની ચર્ચા કરો.	(૧૫)
	અથવા	
પ્રશ્ન.૪	ટ્રેકનોંધ લખો	
	(1) હર્ષદ મેહતા કોભાંડ (2) સત્યમ કોભાંડ (3) કોર્પોરેટ ગવર્નન્સના હેતુઓ	

ENGLISH VERSION

Que.1	(A) Define auditing. Discuss the Objectives of auditing.	(10)
	(B) Explain the importance of computerized accounting method.	(10)
	OR	
Que.1	(A) What is continuous audit? Discuss the advantages and disadvantages it.	(10)
	(B) Explain the points to be considers while preparing audit programme.	(10)
Que.2	State the objectives of internal control and state the principles of internal control.	(20)
	OR	
Que.2	What is Vouching? How would you vouch the following?	
	(1) Commission received. (2) Entertainment Expenses (3) salary	
Que.3	State the duties of an auditor towards verification and valuation of assets.	(15)
	OR	
Que.3	How would you verify and value the Following. (Any two)	
	(1) Debentures (2) Investments (3) Goodwill	
Que.4	Explain the theories (methods) of corporate governance.	(15)
	OR	
Que.4	Write Notes.	
	(1) Harshad Mehta scam.	
	(2) Satyam scam.	
	(3) Objectives of Corporate Governance	
